

ત્વરિત જાહેરાત માટે

બ્રેમ્પટન ટ્રાન્ઝિટ (Brampton Transit) અને ટ્રાન્સહેલ્પ (TransHelp) એક્સેસિબિલિટી એપ સાથે ભાગીદારી કરી સમાવિષ્ટતાના ઉદ્દેશને ટેકો આપે છે

બ્રેમ્પટન, ઓન્ટારિયો (26 સપ્ટેમ્બર 2019) – જ્યારે ઓક્ટોબરમાં ઓટિઝમ જાગૃક્તા માસના ઓજનનો સમય થયો છે ત્યારે મયર પેટ્રિક બ્રાઉન (Mayor Patrick Brown) અને પીલ પ્રાંતના પ્રમુખ નાન્દો ઇયાનિકા (Nando Iannicca) એ આજે બ્રેમ્પટન ટ્રાન્ઝિટ (Brampton Transit), ટ્રાન્સહેલ્પ (TransHelp) અને મેગ્નસકાર્ડ્સ® (MagnusCards®)ની ભાગીદારીની જાહેરાત કરી છે.

મેગ્નસકાર્ડ્સ® (MagnusCards®) એક નિઃશુલ્ક, સ્મત સ્વરૂપની એટલેકે ગેમિફાઇડ એપ છે જે વપરાશકર્તાઓને વિવિધ લાઇફ સ્કેલ્સ શીખવવા માટે મદદરૂપ થતી કાર્ડ ડેક્સ તરીકે ઓળખાતી ડાઉનલોડ થઈ શકે એવી માર્ગદર્શિકાઓ મારફત માળખાયાકૃત, ઉત્તરોત્તર માર્ગદર્શન પૂરું પાડે છે.

બ્રેમ્પટન ટ્રાન્ઝિટ (Brampton Transit) પાસે ડાઉનલોડ કરી શકાય એવા સાત કાર્ડ ડેક્સ ઉપલબ્ધ છે. ભાડા અને PRESTO (Fares and PRESTO), તમારી સફર ગોઠવો (Planning Your Trip), કેવી રીતે બસમાં મુસાફરી કરવી (How to Ride the Bus), બસો કેવી રીતે બદલવી (How to Transfer Buses), તમારી એક્સેસિબિલિટી ડિવાઇસથી બસમાં કેવી રીતે મુસાફરી કરવી (Riding the Bus with Your Accessibility Device), સુરક્ષિત રીતે મુસાફરી કરવી (Riding Safely) અને અઘતન રહેવું (Staying Up To Date).

ટ્રાન્સહેલ્પ (TransHelp) પાસે ડાઉનલોડ કરી શકાય એવા છ કાર્ડ ડેક્સ ઉપલબ્ધ છે. કેવી રીતે સફર બુક કરવી (How to Book a Trip), તમારી સફર માટે કેવી રીતે ચુકવણી કરી શકાય (How to Pay for Your Trip), પીલની સીમાપારનો પ્રવાસ (Travelling Beyond Peel's Borders), અને ટેક્સી સ્ક્રીપ કેવી રીતે ખરીદવી અને વાપરવી (How to Buy and Use Taxi Scrip).

બ્રેમ્પટન ટ્રાન્ઝિટ (Brampton Transit)ના 2019 કસ્ટમર ચાર્ટરમાં રેખાંકિત થયું છે તે અનુસાર સિટી વિશિષ્ટ જ્ઞાનાત્મક જરૂરિયાતો ધરાવતા લોકો તેમજ જેઓ બ્રેમ્પટન ટ્રાન્ઝિટ (Brampton Transit) સિસ્ટમ માટે નવા છે તેઓ માટે વ્યાપક માહિતી ઊભી કરવા અને તેને વિતરિત કરવા માટે પ્રતિબદ્ધ છે. આ સીમાચિહ્નરૂપ ભાગીદારી બ્રેમ્પટનને એક ગ્રીન સિટી બનાવવા અને પીલને જીવનભર સાથે આપનાર સમાજ બનાવવા, જ્યાં લોકો પોતાના જીવનનાં દરેક તબક્કે વિકાસ કરે, તે તરફ પગલાં માંડતો મહત્વપૂર્ણ પ્રયાસ છે.

અહીં વધુ જાણકારી મેળવો www.bramptontransit.com.

અવતરણો

“બ્રમ્પટન ગ્રીન સિટી છે અને અમે સુગમ ટ્રાન્ઝિટ સિસ્ટમ આપવા પ્રતિબદ્ધ છીએ. તેમાં સામેલ છે કે દરેક વ્યક્તિ ટ્રાન્ઝિટનો ઉપયોગ કરવાની સમાન તક મેળવે એવી પરિસ્થિતિઓ ઊભી કરવી. મેગ્નસકાર્ડ્સ® (MagnusCards®) એક વ્યાપક એપ છે જે રહેવાસીઓને અને મુઆકાતીઓને સરળ પહોંચ પૂરી પાડશે જેઓ માટે બ્રમ્પટન અને પીલમાં ટ્રાન્ઝિટનો ઉપયોગ કરવો પડકારરૂપ હોય.”

- મેયર પેટ્રિક બ્રાઉન (Mayor Patrick Brown)

“રહેવાસીઓની જરૂરિયાતો ભિન્ન હોય છે તેથી આપણી મદદ પણ વ્યાપક જ હોવી જોઈશે. અમે એવી એક પહેલ માટે સીટી ઓફ બ્રમ્પટન સાથે ભાગીદારી કરી રહ્યા છે તેનો અમને આનંદ છે કે જે તમામ લોકો માટે પ્રવાસના વિકલ્પો વધારશે અને રહેવાસીઓ વધુ સ્વતંત્ર રહેશે.”

- પીલ રિજનલ ચેર નાન્દો ઈયાનિકા

“મેગ્નસકાર્ડ્સ® (MagnusCards®) મુસાફરનો જાહેર પરિવહનમાં તેમનો અનુભવ વધુ સુખદ બનાવે છે. અમે રિજન ઓફ પીલ સાથે આ સુગમ અને વ્યાપક પહેલ પર કાર્ય કર્યું છે અને અમને આપણા શહેર માટે બ્રમ્પટન ટ્રાન્ઝિટ (Brampton Transit) માટેની સરળ માર્ગદર્શિકાઓ પ્રસ્તુત કરતા ગૌરવની લાગણી થાય છે.”

- એલેક્સ મિલોજેવિક, જનરલ મેનેજર, બ્રમ્પટન ટ્રાન્ઝિટ

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રમ્પટનમાં 650,000 લોકો વસે છે અને તમાં 70,000 વ્યાપારો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતા પ્રવાસનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. અહીં વધુ જાણકારી મેળવો www.brampton.ca.

મિડિયા સંપર્ક:

મોનિકા દુગ્ગલ

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રમ્પટન

905-874-3426 | Monika.Duggal@brampton.ca

મિડિયા સંપર્ક :

રેચલ બ્રાઉન

કમ્યુનિકેશન્સ સ્પેશ્યાલિસ્ટ, ટ્રાન્સહેલ્પ (TransHelp)

905.460.6784 | rachelle.brown@peelregion.ca